

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ

<https://gpssb.gujarat.gov.in>

બ્લોક નં.૨, પાંચમો માળ, કર્મચોગી ભવન, સેક્ટર-૧૦/એ, ગાંધીનગર

પ્રોવીઝનલ મેરીટયાદીમાં સમાવિષ્ટ ઉમેદવારોના પ્રમાણપત્ર ચકાસણી અંગેની અગત્યની જાહેરાત

૧. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ધ્વારા જાહેરાત ક્રમાંક:-૧૪/૨૦૨૧-૨૨ મુખ્ય સેવિકા સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૦૫/૦૬/૨૦૨૨ના રોજ લેવાયેલ હતી. આ સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રોવીઝનલ રીઝલ્ટ અને પ્રોવીઝનલ મેરીટ લીસ્ટ મંડળ ધ્વારા તા.૨૫-૦૭-૨૦૨૨ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જે મંડળની વેબસાઇટ <https://gpssb.gujarat.gov.in> ઉપર મુકવામાં આવેલ છે.

૨. આ પ્રોવીઝનલ મેરીટલીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોને નીચે મુજબની વિગતે અસલ પ્રમાણપત્ર ચકાસણી માટે નીચે દર્શાવેલ સ્થળે દરેક ઉમેદવારને ફાળવેલ તારીખ-સમયે જાતે અચૂક હાજર રહેવા જણાવવામાં આવે છે. જે અંગેના ઇમેઇલ, ઉમેદવારે તેની અરજીમાં દર્શાવેલ ઇમેઇલ આઇડી ઉપર મોકલવામાં આવી રહેલ છે. ઉમેદવારને મોકલવામાં આવનાર ઇ-મેઇલ સાથે પ્રમાણપત્રોની અનુક્રમણિકાની નકલ, એટેસ્ટેશન ફોર્મ (નમુનો-૧), અને ઉમેદવારની શૈક્ષણિક લાયકાતની વિગત દર્શાવતું પત્રક (નમુનો-૨) પણ મોકલવામાં આવશે જે ઉમેદવારે ધ્યાનથી વાંચી -સમજી તેમાં જરૂરી વિગતો ભરીને પ્રમાણપત્ર ચકાસણી વખતે આવવાનું રહેશે.

૩. આથી પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાં સમાવિષ્ટ દરેક ઉમેદવારોને તેમને ફાળવેલ તારીખ/સમયે નીચે દર્શાવેલ પ્રમાણપત્રો સહિત (લાગુ પડતા હોય તે) (અસલ પ્રમાણપત્રો સહિત) ચકાસણી માટે નિયત સ્થળે જાતે અચૂક હાજર રહેવા જણાવવામાં આવે છે. જો પ્રમાણપત્ર ચકાસણીની નિયત તારીખ-સમયે કોઇ ઉમેદવાર ગેરહાજર રહેશે તો સંબંધિત ઉમેદવારે તેની ઉમેદવારી કાયમીપણે પાછી ખેંચી લીધી હોવાનું ગણાશે અને ત્યારપછી તે બાબતમાં કોઇપણ દાવો અથવા વિવાદ ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં, તેની સર્વે ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.

ઉમેદવારે રૂબરૂમાં રજૂ કરવાના પ્રમાણપત્રો (અસલ + સ્વપ્રમાણિત નકલો- બે સેટમાં)

ક્રમ	વિગત
૧	ઉમેદવારની ઓનલાઇન અરજીની પ્રિન્ટ નકલ
૨	એટેસ્ટેશન ફોર્મ (નમુનો-૧)
૩	ઉમેદવારની શૈક્ષણિક લાયકાતની સંપૂર્ણ વિગત દર્શાવતું પત્રક (નમુનો-૨)
૪	શાળા છોડયાના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ
૫(૧)	ભરતી નિયમો અને જાહેરાતની જોગવાઇ મુજબના ના સ્નાતક ડિગ્રી પ્રમાણપત્રની પ્રમાણિત નકલ
૫(૨)	ઉપરોક્ત સ્નાતક ડિગ્રીના તમામ સેમેસ્ટર/વર્ષની માર્કશીટની પ્રમાણિત નકલો
૬(૧)	ભરતી નિયમો અને જાહેરાતની જોગવાઇ મુજબના ના અનુસ્નાતક ડિગ્રી પ્રમાણપત્રની પ્રમાણિત નકલ
૬(૨)	ઉપરોક્ત અનુસ્નાતક ડિગ્રીના તમામ સેમેસ્ટર/વર્ષની માર્કશીટની પ્રમાણિત નકલો
૭	ધોરણ-૧૦ ની માર્કશીટની પ્રમાણિત નકલ
૮	ધોરણ-૧૦ ના ટ્રાયલ સર્ટીફિકેટની પ્રમાણિત નકલ
૯	ધોરણ-૧૨ ની માર્કશીટની પ્રમાણિત નકલ
૧૦	ધોરણ-૧૨ ના ટ્રાયલ સર્ટીફિકેટની પ્રમાણિત નકલ
૧૧	કોમ્પ્યુટરના નોલેજ અંગેનું નિયત પ્રમાણપત્રની પ્રમાણિત નકલ
૧૨	જાતિ અંગેનું પ્રમાણપત્ર (SC/ST ઉમેદવારોના કિસ્સામાં) ની પ્રમાણિત નકલ
૧૩	સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોના કિસ્સામાં નોનકિમીલેયર પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો) ની પ્રમાણિત નકલ + બાંહેધરીપત્ર અસલમાં રજૂ કરવું.
૧૪	આર્થિક રીતે નબળા વર્ગ(EWS)ના ઉમેદવારોના કિસ્સામાં EWS અંગેના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ + બાંહેધરીપત્ર અસલમાં રજૂ કરવું.

૧૫	શારીરિક અશક્તતા (દિવ્યાંગ ઉમેદવાર હોવા) અંગેના સામાન્ય વહીવટ વિભાગના તા.૧/૧૨/૨૦૦૮ના પરીપત્ર મુજબના નિયત પ્રમાણપત્રની પ્રમાણિત નકલ (લાગુ પડતું હોય તો) (પ્રમાણપત્રનો નમૂનો મંડળની વેબસાઇટ ઉપર “ ડાઉનલોડ” ફોલ્ડરમાં મુકેલ છે, જે જોઈ લેવો)
૧૬	વિધવા હોવા અંગેના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ (લાગુ પડતું હોય તો)
૧૭	માન્ય રમતગમત (Sports)ના વધારાના ગુણ મેળવવા માટેના નિયત પ્રમાણપત્રની પ્રમાણિત નકલ (લાગુ પડતું હોય તો)
૧૮	ઉમેદવારના આધારકાર્ડની પ્રમાણિત નકલ
૧૯	ઉમેદવારના પાનકાર્ડ(જો હોય તો)ની પ્રમાણિત નકલ (ધરાવતા ન હોય તો મેળવેલ નથી તેવું લખવું)
૨૦	પાસપોર્ટ સાઇઝના વધારાના બે ફોટા (એક કાગળ ઉપર ચોટાડી તેની નીચે નામ લખી સહી કરી લાવવાના રહેશે.)
૨૧	નામમાં ફેરફાર કરાયેલ હોય તો તે અંગેના સરકારી ગેઝેટ વિગેરે આધારોની પ્રમાણિત નકલ
૨૨	પરિણિત મહિલા ઉમેદવારના કિસ્સામાં અરજી અને પ્રમાણપત્રોના નામમાં વિસંગતતા હોય તો લગ્ન નોંધણી પ્રમાણપત્રની પ્રમાણિત નકલ, તેમજ એક જ વ્યક્તિ હોવા બદલના સોંગદનામાની પ્રમાણિત નકલ.
૨૩	ગુજરાત સરકારના સરકારી/અર્ધ સરકારી/સરકાર હસ્તકના કોર્પોરેશન/ કંપનીઓમાં સેવા બજાવતા અધિકારીઓ/કર્મચારીઓના કિસ્સામાં નિયત નમુનામાં સક્ષમ અધિકારી ધ્વારા આપવામાં આવેલ ”ના વાંધા પ્રમાણપત્ર”(લાગુ પડતું હોય તો)

પ્રમાણપત્ર ચકાસણી કાર્યક્રમ
(મુખ્યસેવિકા-વર્ગ-૩)

પ્રમાણપત્ર ચકાસણીની તારીખ	પ્રમાણપત્ર ચકાસણીનો સમય	પ્રોવીઝનલ મેરીટ લીસ્ટના SR No.	પ્રમાણપત્ર ચકાસણીનું સ્થળ	
તા.૩૦-૦૭-૨૦૨૨ શનિવાર	સવારે ૧૦:૦૦ કલાકે	૧ થી ૪૫	જિલ્લા પંચાયત કચેરી- આણંદ કોમન હોલ, ચોથો માળ, ડી.એસ.પી ઓફીસ પાસે, બોરસદ ચોકડી, આણંદ	
	બપોરે ૧૪:૩૦ કલાકે	૪૬ થી ૯૦		
તા.૦૧-૦૮-૨૦૨૨ સોમવાર	સવારે ૧૦:૦૦ કલાકે	૯૧ થી ૧૩૫		
	બપોરે ૧૪:૩૦ કલાકે	૧૩૬ થી ૧૮૦		
તા.૦૨-૦૮-૨૦૨૨ મંગળવાર	સવારે ૧૦:૦૦ કલાકે	૧૮૧ થી ૨૨૫		
	બપોરે ૧૪:૩૦ કલાકે	૨૨૬ થી ૨૭૦		
તા.૦૩-૦૮-૨૦૨૨ બુધવાર	સવારે ૧૦:૦૦ કલાકે	૨૭૧ થી ૩૧૫		
	બપોરે ૧૪:૩૦ કલાકે	૩૧૬ થી ૩૩૯		
તા.૨૮-૦૭-૨૦૨૨ ગુરુવાર	સવારે ૧૧:૦૦ કલાકે	૩૪૦ થી ૩૭૪		ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની કચેરી, બ્લોક નં.૨, કર્મચોગી ભવન, ડી વીંગ, પાંચમો માળ, સેક્ટર-૧૦/એ, ગાંધીનગર
	બપોરે ૧૫:૦૦ કલાકે	૩૭૫ થી ૪૦૪		

“મંડળના આદેશાનુસાર”

તારીખ:-૨૬-૦૭-૨૦૨૨

સચિવ